

તમને અમેરિકાના કયા વિઝા જોઈએ છે?



ય વિઝામિત્રો, શ્રંખલાને આજે આપણે આગળ વધારીએ. વિઝાના બે મુખ્ય પ્રકારો છે, ઈમિગ્રન્ટ અને નોનઈમિગ્રન્ટ. ઈમિગ્રન્ટ વિઝા પર તમે જઈને અમેરિકામાં હંમેશા માટે રહી શકો છો. તમે જ્યારે નોનઈમિગ્રન્ટ વિઝા પર જાવ છો ત્યારે તમારી પાસે જે પ્રકારના વિઝા હોય એને લગતું કાર્ય કરીને તમને આપેલા સમય સુધીમાં તમારે તમારા દેશમાં પાછા આવતા રહેવું પડે છે. આગળના બે મહાકામાં આપણે અમેરિકાના A થી V નોનઈમિગ્રન્ટ પ્રકારના વિઝા વિશે, આ વિઝા કોને આપવામાં આવે છે, એ વિઝા પર જઈને તમે કયું કાર્ય કરી શકો છો અને કોને કોને સાથે લઈ જઈ શકો છો એ સઘળું વિગતવાર જાણ્યું.

આજની શ્રંખલામાં આપણે હવે ઈમિગ્રન્ટ વિઝા વિશે જાણીશું.

ઈમિગ્રન્ટ વિઝા મળતાં તમે અમેરિકામાં પરમેનેન્ટ રેસીડેન્ટ તરીકે પ્રવેશી શકો છો. તમે જ્યારે દાખલ થાવ છો ત્યારે તમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે.

- આ ઈમિગ્રન્ટ વિઝા મુખ્ય ચાર કેટેગરીમાં વહેંચાયેલા છે.
- 1) ફેમિલી બેઝ ઈમિગ્રન્ટ વિઝા,
- 2) એમ્બોયમેન્ટ બેઝ વિઝા
- 3) ડાઈવર્સિટી વિઝા
- 4) બીજા સ્પેશિયલ ઈમિગ્રન્ટ વિઝા.

(1) ફેમિલી બેઝ ઈમિગ્રન્ટ વિઝા:- અમેરિકાના નાગરિક અથવા ગ્રીનકાર્ડધારક પોતાના ફેમિલી માટે ફેમિલી બેઝ ઈમિગ્રન્ટ વિઝા સ્પોન્સર કરીને એમને હંમેશ માટે અમેરિકામાં બોલાવી શકે છે.

આમાં સૌથી પ્રથમ આવે છે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી. આ વિઝા કવોટાના બંધનોથી સીમિત નથી. ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ પોતાના ફેમિલીના સભ્ય માટે પિટિશન દાખલ કરી શકો છો અને એ પિટિશન જેવું એપ્રુવ થાય કે તરત જ તમારા ફેમિલીનો એ સભ્ય અમેરિકામાં દાખલ થઈ શકે છે. એકવાર પિટિશન એપ્રુવ થઈ જાય પછી એણે કોઈપણ પ્રકારની લાઈનમાં ઊભા રહેવું નથી પડતું એ તુરંત જ અમેરિકામાં દાખલ થઈ શકે છે અને એને અમુક સમયની અંદર ગ્રીનકાર્ડ પણ મળી જાય છે. એમાં કોઈ વાર્ષિક કવોટાના બંધનો નથી. આ વિઝા હંમેશા કરંટ એટલે કે ખુલ્લા જ હોય છે.

IR-1:- ઈમિજિયેટ રિલેટિવ-1 હેઠળ આવે છે અમેરિકન સિટીઝનના પતિ યા પત્ની. અમેરિકન સિટીઝન પતિ કે પત્ની પોતાના જીવનસાથી માટે IR-1 હેઠળ પિટિશન દાખલ કરીને એના માટે વિઝા મેળવી શકે છે.



IR-2:- ઈમિજિયેટ રિલેટિવ-2 હેઠળ આવે છે અમેરિકન સિટીઝનના 21 વર્ષની નીચેની વયના અવિવાહિત સંતાનો. અમેરિકન સિટીઝન પોતાના 21 વર્ષની નીચેના સંતાન માટે આ IR-2 હેઠળ પિટિશન દાખલ કરી શકે છે અને એ એપ્રુવ થતાં જ એ સંતાનને અમેરિકામાં દાખલ થવા મળી જાય છે અને એને તુરંત જ ગ્રીનકાર્ડ પણ મળી જાય છે.

IR-5:- ઈમિજિયેટ રિલેટિવ-5 આ કેટેગરી હેઠળ અમેરિકામાં રહેતા સંતાનો જે અમેરિકન સિટીઝન હોય એ પોતાના માતા પિતા માટે IR-5 હેઠળ પિટિશન દાખલ કરી શકે છે અને એ એપ્રુવ થતાં જ એના માતા પિતા અમેરિકામાં ઈમિગ્રન્ટ વિઝા હેઠળ તુરંત જ દાખલ થઈને ગ્રીનકાર્ડ મેળવી શકે છે. ત્યારબાદ આવે છે ફેમિલી પ્રેફરન્સ F વિઝા.

આ વિઝા વાર્ષિક કવોટા ના બંધનોથી સીમિત છે. એના હેઠળ પિટિશન દાખલ કર્યા બાદ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ વિઝાના પિટિશન એપ્રુવ થયા બાદ એને કરંટ થતા ઘણો સમય લાગી જાય છે, કારણ કે એના ફિક્સ કવોટા હોય છે. જે પૂરા થઈ જતાં એ સમયના લોકો પાછળના બીજા વર્ષમાં ધકેલાય છે અને એમ કરતાં લાઈન લાંબી થતી જાય છે.

F-1:- અમેરિકામાં સિટીઝન માતા-પિતાના 21 વર્ષથી વધુની વયના

અવિવાહિત સંતાનો આ કેટેગરી હેઠળ આવે છે. માતા યા પિતા પોતાના 21 વર્ષથી વધુની વયના અવિવાહિત સંતાન માટે પિટિશન દાખલ કરી શકે છે.

આ પિટિશન એપ્રુવ થાય અને કરંટ થાય ત્યાં સુધી એ સંતાને અવિવાહિત જ રહેવું પડે છે. શરત એ છે કે એ અમેરિકામાં ઈમિગ્રન્ટ વિઝા હેઠળ દાખલ થાય ત્યારે પણ એ સંતાન અવિવાહિત હોવું જોઈએ.

F-2A:- અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવનાર વ્યક્તિ પોતાના પતિ/પત્ની અને 21 વર્ષથી ઓછી વયના અવિવાહિત સંતાન માટે ગ્રીનકાર્ડનું તમે જ્યારે નોનઈમિગ્રન્ટ વિઝા પર જાવ છો ત્યારે તમારી પાસે જે પ્રકારના વિઝા હોય એને લગતું કાર્ય કરીને તમને આપેલા સમય સુધીમાં તમારે તમારા દેશમાં પાછા આવતા રહેવું પડે છે

પિટિશન દાખલ કરી શકે છે. એ એપ્રુવ થતાં અને કરંટ થતાં પતિ કે પત્ની અને એ અવિવાહિત સંતાન અમેરિકામાં દાખલ થઈ શકે છે.

F-2B:- અમેરિકન ગ્રીનકાર્ડ ધરાવનાર માતા યા પિતા પોતાના 21 વર્ષથી વધુની વય ધરાવતા અવિવાહિત સંતાન માટે પિટિશન દાખલ કરી શકે છે.

આ પિટિશન એપ્રુવ અને કરંટ થતાં જ આ અવિવાહિત સંતાન અમેરિકામાં ઈમિગ્રન્ટ વિઝા હેઠળ દાખલ થઈ શકે છે.

F-3:- અમેરિકન સિટીઝનના પરિણીત પુત્ર યા પુત્રી માટે માતા યા પિતા પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશન પણ એપ્રુવ અને કરંટ થતાં જ એ પુત્ર અને પુત્રી અમેરિકામાં પ્રવેશી શકે છે.

F-4:- અમેરિકન સિટીઝન 21 વર્ષથી ઉપરની વયના પોતાના ભાઈ અને બહેન માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન ફાઈલ કરી શકે છે. એ પિટિશન એપ્રુવ અને કરંટ થતાં જ તેઓ અમેરિકામાં દાખલ થઈ શકે છે. આ બધા જ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરેલા પિટિશનમાં જેના માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એમના ડિપેન્ડન્ટ માટે પણ પિટિશન ફાઈલ કરી શકાય છે અને એ એપ્રુવ અને કરંટ થતાં જ એમને પણ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

તો વિઝામિત્રો, આ હતી ફેમિલી બેઝ કેટેગરી જેના હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. બાકીની ત્રણ કેટેગરી વિશે આપણે વાત કરીશું આવતા લેખોમાં. (ક્રમશઃ)



જેતરમાં સુરત શહેરમાં ખાડી પૂર (Creek Flood) અને ભારે વરસાદના કારણે મિડલ ક્લાસ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી એક વાર પાણી ફરી વળ્યાં છે. અખબારો અને મીડિયા અહેવાલો અનુસાર, આ પૂરના કારણે હજારો પરિવારો, નાના વેપારીઓ અને કારખાનાના માલિકોને કરોડો રૂપિયાનું માલસામાન, ફર્નિચર અને મશીનરીનું નુકસાન થયું છે. આવા કપરા સમયે જે લોકો પાસે પ્રોપર્ટી અથવા સ્ટોકનો વીમો (Insurance) છે, તેઓ વીમા કંપની પાસે ક્લેમ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે મુશ્કેલીના સમયે વીમા કંપનીઓ ગ્રાહકોને વળતર ચૂકવવામાં અનેક આનાકાની અને ટેક્નિકલ અવરોધો ઊભા કરે છે. આવા સમયે ગભરાવાને બદલે ભૂતકાળના કાનૂની ચુકાદાઓનો અભ્યાસ કરવો જરૂરી છે.

વર્ષ ૨૦૦૬માં સુરતમાં આવેલા ઐતિહાસિક અને વિનાશક પૂર બાદ વીમા કંપનીઓએ અનેક વાજબી ક્લેમ નકારી કાઢ્યા હતા, જેની સામે ગ્રાહકોએ ગ્રાહક કમિશનમાં વર્ષો સુધી કાનૂની લડત આપીને ન્યાય મેળવ્યો હતો. આ ઐતિહાસિક કેસો આજે ૨૦૨૬ના પૂરપીડિતો માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.

અહીં ગ્રાહક કમિશનના એવા આઠ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાઓનો વિગતવાર સારાંશ પ્રસ્તુત છે, જે વીમાધારકોને તેમના હક મેળવવામાં મદદરૂપ થશે.

અત્રે એ પણ નોંધનીય છે કે આ તમામ કેસોમાં અસરગ્રસ્ત ફરિયાદી પક્ષકારોના એડવોકેટ શ્રેયસ દેસાઈ હતા.

૧. પૂરના સ્પષ્ટ પુરાવા સામે વીમા કંપનીનું માત્ર 'અનુમાન' ન ચાલે

૨૦૦૬ના સુરત પૂરના ઐતિહાસિક ચુકાદા; ૨૦૨૬ના પૂરપીડિતો માટે માર્ગદર્શક દીવાદાંડી



કેસ: કંચનભાઈ કંથારિયા વિ. યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ.

પરિસરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફરિયાદીની કાપડની ફેક્ટરીમાં ૧૨થી ૧૬ ફૂટ પાણી ભરાવા છતાં વીમા કંપનીએ 'મિલકતને કોઈ નુકસાન થયું નથી' તેવું હાસ્યાસ્પદ બહાનું કાઢી ક્લેમ નકાર્યો હતો. ફરિયાદીએ સુરત મહાનગરપાલિકા (SMC)નું પાણી ભરાયાનું પ્રમાણપત્ર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)

ઇતિહાસ સાક્ષી છે કે મુશ્કેલીના સમયે વીમા કંપનીઓ ગ્રાહકોને વળતર ચૂકવવામાં અનેક આનાકાની અને ટેક્નિકલ અવરોધો ઊભા કરે છે

ના સત્તાવાર દસ્તાવેજો રજૂ કર્યા. ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશને વીમા કંપનીનો નિર્ણય ગેરવાજબી ઠેરવતાં સ્પષ્ટ કર્યું કે, જ્યારે પૂરના પ્રત્યક્ષ પુરાવા ઉપલબ્ધ હોય ત્યારે કંપની માત્ર પોતાના કાલ્પનિક

અનુમાનના આધારે ક્લેમ નકારી શકે નહીં.

૨. વીમા કંપનીના સર્વેયરનો અહેવાલ અંતિમ કે સર્વોપરી નથી

કેસ: ભારતીબેન શાહ અને દિલીપભાઈ શાહ વિ. ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.

ઉમરા વિસ્તારના બંગલામાં પૂરના પાણી ભરાવાથી ફર્નિચર અને ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. વીમા કંપનીના સર્વેયરે નુકસાનનું ઓછું મૂલ્યાંકન કરીને માત્ર રૂ. ૩.૧૬ લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી. ફરિયાદીએ આર્કિટેક્ટ અને નિષ્ણાતોના ટેક્નિકલ અહેવાલો રજૂ કર્યા. રાજ્ય ગ્રાહક કમિશને સર્વેયરના રિપોર્ટને નકારીને ફરિયાદીની તરફેણમાં આશરે રૂ. ૮.૩૦ લાખ વ્યાજ અને વળતર સાથે ચૂકવવાનો આદેશ કર્યો. કમિશને ઠરાવ્યું કે સર્વેયરનો અહેવાલ આખરી નથી અને ન્યાયના હિતમાં તેનું પુનઃમૂલ્યાંકન થઈ શકે છે.

૩. કંપની પોતાના જ નિયુક્ત કરેલા સર્વેયરના મહત્વનાં તારણો અવગણી ન શકે

કેસ: મનજીતસિંહ કે. વિ. યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ. રિવર પાર્ક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલા કોલ્ડ સ્ટોરેજના આ કેસમાં પૂરથી ભારે તારાજ થઈ હતી. વીમા કંપનીએ માત્ર રેફ્રિજરેશન યુનિટનો ક્લેમ સ્વીકાર્યો પરંતુ કોલ્ડરૂમના નુકસાનનો ઇનકાર કર્યો. સર્વેયરના ફોટોગ્રાફ્સ અને ટેક્નિકલ રિપોર્ટના આધારે ગ્રાહક કમિશને કંપનીને રૂ. ૧૪.૮૫ લાખ ચૂકવવાનો આદેશ આપતાં નોંધ્યું કે, વીમા કંપની પોતાના જ

અનું પાના 5 પર

કેન્ડલ લાઇટ

- અંધાંતું ગમે તેટલું ઘેરી વળે તો પણ શું?
- ન્યાયની એક નાની મીલાબતી હજારો અન્યાયી અંધકાર પર ભારે પડે છે.